


બસ

- બસ એટલે વીજકીય પરિપથ કે જેના વડે બીટનું વહન થાય છે.
- કમ્પ્યુટરમાં દરેક ભાગમાં માહિતી પહોંચાડવા માટે દરેક ભાગ સર્કિટ અથવા કનેક્શનથી જોડાયેલા હોય છે. જેને આપણે બસ કહીશું.
- બસ એટલે ડેટાનો હાઈ-વે એટલે કે જે માર્ગે ડેટા કે માહિતીનું વહન થાય છે તે માર્ગ
- ડેટા વહન બે રીતે થઈ શકે
 - દરેક ભાગને જુદા જુદા વાયર વડે સાંકળી શકાય
 - દરેક ભાગને વાયરના એક જ સેટ દ્વારા સાંકળી શકાય (બસ)
 - સરકીટની સંખ્યા અને કિંમતમાં ઘટાડો

System and Peripheral Buses This illustration shows how chips, memory and peripherals in a PC interconnect via the system bus (top) and peripheral buses (AGP, PCI and PCI Express).

From Computer Desktop Encyclopedia
© 2005 The Computer Language Co. Inc.



બસના પ્રકાર

૧. સિસ્ટમ બસ
૨. લોકલ બસ

સિસ્ટમ બસ

- સિસ્ટમ બસ એ કનેક્શનનો એવો સમૂહ છે કે જે સી.પી.યુ.ને બીજા સાધનો સાથે જોડે છે
- સિસ્ટમ બસમાં ત્રણ પ્રકારની લાઈન
 - એડ્રેસ બસ
 - ડેટા બસ
 - નિયંત્રણ (કંટ્રોલ) બસ

- એડ્રેસ બસ :ડેટાનું સરનામું બીટ્સ સ્વરૂપે સી.પી.યુમાં જાય છે. પ્રત્યેક સૂચન કે માહિતી કે ડેટાના વહન માટે સરનામું જરૂરી
- ડેટા બસ
 - :ડેટાનું વહન કરે છે
 - બસની પહોળાઈનો આધાર ડેટા લાઈન્સની સંખ્યા પર આધારિત
 - આમ ડેટા બસ એ સીધમાં આવેલા વાયરોનો સેટ ગણાય, દરેક વાયર એક સમયે એક બીટનું વહન કરે – બસમાં જેટલા વધુ વાયર તેટલા વધુ બીટ એક સાથે મોકલી શકાય
 - પહેલાં ૮ વાયરોનો સેટ હતો, પછી ૧૬ અને ત્યારબાદ ઉત્તરોત્તર વધારો થતો રહ્યો છે.
- નિયંત્રણ બસ : સી.પી.યુ.ના નિયંત્રણ એકમને મેમરી સાથે જોડનાર બસ. આમથતાં સંકેતોને અન્ય વિભાગમાં મોકલવામાં આવે છે.

લોકલ બસ

- બસની વહન ક્ષમતા વધે ત્યારે તેની સાથે જોડાયેલા કમ્પ્યુટરના ઘટકોની કાર્યક્ષમતા પણ વધવી જોઈએ. જો એમ ન થાય તો ટ્રફીક જામ જેવી સ્થિતિ થાય. તેના ઉકેલ રૂપે લોકલ બસ
- લોકલ બસ એટલે કમ્પ્યુટરના સિસ્ટમ બસમા વધારાની બસ ઉમેરવામાં આવે છે.
- જેમાં કમ્પ્યુટરના અમુક સાધનોને ઈનપુટ આઉટપુટ બસથી છૂટા કરી સીધા સી.પી.યુ. અને મેમરી સાથે જોડી શકાય છે. જેથી ડેટા મેમરીમાંથી સીધા માઈક્રોપ્રોસેસર દ્વારા સ્ક્રીન અને બીજા ભાગોમાં મોકલી શકાય છે.
- શરૂઆતમાં ISA નો ઉપયોગ થતો, જેની ક્ષમતા પ્રતિ સેકન્ડ ૧૬ બીટ હતી.
- ત્યારબાદ EISA નો ઉપયોગ, જેની ક્ષમતા પ્રતિ સેકન્ડ ૩૨ બીટસ
- અત્યારે PCI ની ક્ષમતા ૨૫૬ બીટસ




Fig 7 - Numbering system for 50-Way Speedbloc connectors

પેરિફરલ્સ


- જે સાધનોને પ્લગ દ્વારા કમ્પ્યુટર સાથે જોડવામાં આવે તે સાધનોને પેરિફરલ્સ કહે છે.
- દા.ત. મોડેમ, ફી બોર્ડ, પિન્ટર, સ્કેનર, માઉસ વગેરે
- બધાં જ ઈનપુટ અને આઉટપુટ ડિવાઈસીસનો સમાવેશ થાય

પોર્ટ

- પોર્ટ એટલે બંદર
- મોટાભાગે કમ્પ્યુટરના પાછલા ભાગમાં આવેલા સોકેટ્સ
- પોર્ટમાં કેબલ્સ નાંખીને પેરિફરલ્સને કમ્પ્યુટર સાથે જોડવામાં આવે છે.
- પોર્ટના પ્રકાર
 - શ્રંખલા પોર્ટ
 - સમાંતર પોર્ટ
 - સ્ક્રી પોર્ટ
 - સાર્વત્રિક શ્રંખલા બસ પોર્ટ
 - ફાયર વાયર કનેક્શન પોર્ટ


શ્રંખલા પોર્ટ (Serial Port)

- એક સમયે એક જ બીટનું વહન
- ડેટા ખૂબ જ ધીમી ઝડપે અને દૂર સુધી
- ઇ.ત. મોડેમ જોડવા માટે



સમાંતર પોર્ટ


- એક સમયે એક સાથે આઠ બીટનું વહન
- ડેટાનું વહન શ્રંખલા પોર્ટ કરતાં ઝડપી પણ અંતર ઓછું
- પ્રિન્ટર



DB-25 male to DB-25 female

સ્કઝી પોર્ટ (Scuz-e Port)

- સ્કઝી એટલે - **Small Computer System Interface-SCSI**
- એક જ પોર્ટમાં એક સાથે એક કરતાં વધુ પેરિફરલ્સને જોડી શકાય
- એક સાધન સાથે બીજું, બીજા સાધન સાથે ત્રીજું એ રીતે



સાર્વત્રિક શ્રંખલા બસ પોર્ટ (Universal Serial Bus....USB)

- ઈનપુટ આઉટપુટ સાધનો દ્વારા ડેટાની માંગ વધવા લાગી
- ટ્રાફિક જામ જેવી સ્થિતિ નિવારવા
- સાર્વત્રિક શ્રંખલા બસ ને કોઈ પોર્ટ સાથે જોડવામાં આવે છે જેને યુ.એસ.બી.પોર્ટ કહે છે
- એક જ પોર્ટમાં એક સાથે ૧૨૭ સાધનો જોડી શકાય છે.



झायर वायर कनेक्शन पोर्ट

- यु.एस.जी. करतां वधु ञडपी
- वधु भर्थाण



Key Board




Monitor



Parallal





Pin number	Wire Color
------------	------------

Pin 1 ==>	Orange/White
Pin 2 ==>	Orange
Pin 3 ==>	Green/White
Pin 4 ==>	Blue
Pin 5 ==>	Blue/White
Pin 6 ==>	Green
Pin 7 ==>	Brown/White
Pin 8 ==>	Brown


Straight-Through

Wire	Becomes
1	➔ 1
2	➔ 2
3	➔ 3
6	➔ 6

Pin number	Wire Color
------------	------------

Pin 1 ==>	Orange/White
Pin 2 ==>	Orange
Pin 3 ==>	Green/White
Pin 4 ==>	Blue
Pin 5 ==>	Blue/White
Pin 6 ==>	Green
Pin 7 ==>	Brown/White
Pin 8 ==>	Brown

Vedio Port



DVI-D Single Link

DVI-A

DVI-I Single Link


Digital Only

Analog Only


Digital & Analog



Digital Only



round the blade



Digital & Analog



Three rows of eight pins and a solitary flat blade

Three rows of eight pins and four contacts around the blade

USB Port



Firewire



Jack for Telephone and LAN



Audeo Jack



ઓપરેટીંગ સિસ્ટમ

- સોફ્ટવેર છે
- કમ્પ્યુટરમાં થતાં કાર્યોનું સંકલન અને નિયંત્રણ કરે છે
- સોફ્ટવેર અને હાર્ડવેર વચ્ચે સંકલન કરે છે
- કમ્પ્યુટરને ચાલુ કરવામાં આવે ત્યારે ઓ.એસ. મેમરીમાં લોડ થાય છે. જેને બુટીંગ કહે છે. કમ્પ્યુટરના દરેક પાર્ટની ચકાસણી કરે છે.
- ઈનપુટ અને આઉટપુટ પર નિયંત્રણ રાખે છે
- કમ્પ્યુટરમાં કોઈ ખામી હોય તો તરત જ મોનીટર પર જણાવે છે
- ઇ.ત. Dos, Win95, Win98, NT2000, Linux, Unix, Vista,

ઓપરેટીંગ સિસ્ટમના અન્ય વિશિષ્ટ કાર્યો

- **મલ્ટી ટાસ્કીંગ** : એક સાથે એક જ સમયે એક જ કમ્પ્યુટર પર એકથી વધુ પ્રોગ્રામનો ઉપયોગ કરી શકાય.
- હકીકતમાં એકપણી એક કામ થાય છે, પણ ક્રિયા ઝડપી હોવાથી આપણને એમ લાગે કે બંને એક સાથે થાય છે.
 - દા.ત. ઈન્ટરનેટ પરથી કોઈ ફાઈલ ડાઉનલોડ થતી હોય અને સાથે જ આપણે વર્ડ પર કોઈ કામ કરતા હોઈએ.
- **મલ્ટીથ્રેડિંગ** : એક જ પ્રોગ્રામમાં એક સાથે એક કરતાં વધુ કાર્યો કરવા.
 - દા.ત. વર્ડમાં આપણે લખાણ લખતા હોઈએ અને સાથે પ્રિન્ટ પણ લેતા હોઈએ.

- **મલ્ટી યુઝર** : એક સાથે એક જ સમયે એક કમ્પ્યુટર પર એક કરતાં વધુ વ્યક્તિ કામ કરતા હોય.
 - ખાસ કરીને મીની, મેઈનફ્રેમ, સુપર કમ્પ્યુટરમાં ઉપયોગ
- **મલ્ટી પ્રોસેસર** : એક જ કમ્પ્યુટરમાં એક કરતાં વધુ પ્રોસેસર આવેલા હોય

ફાઈલ મેનેજમેન્ટ

- ફાઈલ અને ફાઈલનું નામ

- ફાઈલને સેવ કરો ત્યારે તે ફાઈલ મુખ્યનામ અને વધારાના (Extention) નામ સાથે સેવ થાય છે.

- બંને વચ્ચે દશાંશ ચિહ્નનો (.) સંકેત મૂકવામાં આવે છે

- ફાઈલનું નામ કેટલા કેરેક્ટર તેનો આધાર ઓ.સિ. પર છે. ઘા.ત. DOSમાં આઠ, WIN માં ૨૫૯ સુધી

- Extention નામ ત્રણ કેરેક્ટર સુધી જ ઘા.ત. **.doc** હોય તો વર્ડની ફાઈલ, **.bmp** હોય તો ગ્રાફિક્સની ફાઈલ, **.ppt** હોય તો પાવર પોઈન્ટની ફાઈલ ઘા.ત. **ashok.doc, ashok.bmp,**

મોટા ભાગની ઓ.સિ.માં વધારાનું નામ આપવાની જરૂર નથી. કમ્પ્યુટર જાતે જ લઈ લે છે.

ફાઈલના નામ પરથી ખ્યાલ આવે છે કે તે કઈ એપ્લિકેશનમાં બનેલી છે.

ફાઈલ ખોલો ત્યારે સૌ પ્રથમ એપ્લિકેશન ખૂલે પછી ફાઈલ ખૂલે

શોલ-ડર

- એક ઓફિસની કલ્પના કરો
- જુદા જુદા ડોક્યુમેન્ટસ માટે જુદી જુદી તિજોરી
- તિજોરીમાં પણ જુદા જુદા ખાના
- જુદા જુદા ખાનામાં અનેક ફાઈલ

ડ્રાઈવ્સ (Drives)

- જેમાં હાર્ડ ડિસ્ક, ફ્લોપી, સી.ડી. વગેરે મૂકી શકાય તેને ડ્રાઈવ્સ કહે છે.
- ડ્રાઈવ્સના નામ A,B,C વગેરે આપવામાં આવે છે.

ટ્રી

- કોઈપણ એક ડ્રાઈવ્સ પર આવેલા ફોલ્ડરના સમૂહને દર્શાવવાનો એક માર્ગ
- ૩૮ ડિરેક્ટરી, ફોલ્ડર, ફાઈલની ગોઠવણીના તાર્કિક માળખાને
- કમ્પ્યુટરમાંથી એક ડ્રાઈવ્સની ટ્રી જોઈએ.

પાથ

- રૂટ ડિરેક્ટરીમાં કોઈપણ ફાઈલ કયા ફોલ્ડરમાં કયા સ્થળે આવેલી છે તે પાથ દ્વારા જાણી શકાય છે.
- દા.ત. D:\SUG\Ashok\Guj.doc
- :સંકેત દ્વારા અને \ સંકેત ફોલ્ડર જણાવે છે.

- ફાઇલફોરમેટીંગ
- ફ્રેગમેન્ટેશન